



2nd Edition

#### 15th August, 2016 6:00 AM to 12 Noon

Organized by



# 1

# The Concept

- 4 team of 3 male participants running for 2 hours
- 1 team of6 female participants running for 1 hour
- 5 Referees from each club for guiding & helping
- The top 3 male team and female team winners will announced as per the highest distance covered in 6 hours.
- Trophy for the top three Club or Gym best



Health & Fitness for all

Independence Day

### **Glimpses of 1st Edition** Total 25 Teams Participated







# **Participant Clubs**





#### RAJPATH CLUB



# Winners of 1st Edition

- Team Women Winner was Karnavati Club Team Covering a distance of 63.71kms in 6 hours
- Team Men winners 1<sup>st</sup> to 4<sup>th</sup> Position is as follows
- **1**<sup>st</sup> Team Rajpath Club 73.90kms in 6 hours
- **2<sup>nd</sup>** Team Rajpath Club 66.61kms in 6 hours
- **3**<sup>rd</sup> Team Ellisbridge Gymkhana 65.13kms in 6hours
- 4<sup>th</sup> Team Rajpath Club 64.90kms in 6 hours

#### A total distance of **1251kms was covered**

The Team Trophy for covering highest distance went to **Rajpath club** for scoring a distance of 298.30kms in 6 hours by their 5 teams!!!







# Media Coverage


#### LOCAL ROUND-UP

#### Rajpath men, Karnavati women finish on top



The Kamavati Club women's team comprising of Pragnya Mohan, Himadri, Jyotika, Karishma, Shruti and Panushree won top honours in the Independence Day Tread Mill Run organized by LS sports. They covered a distance of 63.71kms in six hours. The Raipath Club men's team comprising of Bhavin Agarwal, Dr Jagat Patel and Shallesh Javia won in the male category by covering a whopping 73.90kms in six hours. This was a tham event where three males of any age

and the second s



Inter-club aquatic championship: Host Ellisbridge Gymkhana emerged on top in the Inter-Club Aquatic Championships with 495 points. Sports Club came second with 441 points followed by Rajpath (174), Karnavati (61) and Rifle Club (54). Nell Contractor and Manna Patel were two of the star attraction of the meet where more than 300 participants took part. Among other events, competition was also held for





#### Independence Day 6 hrs treadmill run

Teves, News Revision

Ahmedahad: An Independ ence Day six hours tranheiti nut at various clobs in the city will be held on August 15 under the negla of LS Sporta.

Noted marailhon nunner and promoter of the event Lihas Trived and "This will give an opportunity to runners in the city to participate on behalf of clubs transmost which is filled with fue and competition. This will slee help ments a running culture. in our city"

Competitions will be held in male and female statestories. Each male toam will have three cumpers and each runner will run in a two hour alot fornix hours. There will hosts members in the firms le category and each participant will run for one hour Bach club can send one neuro entry for fomale porticipants. The total number of KMs done by each ing his entry into the Linca Book team in the stipulated hours of Record in June last year when will be counted to declare the he ran 194,2 km in 26 mors.

Uhas fived) up the treadmiti da

WINDOW PLATERING Registration is free for the should have participated in a event and each participant, 10km sup or a half marathon should be above 18 years and event earlier.

પાંચ કલળ વચ્ચે ચોજારોલી ટ્રેડ મીલ ૨નમાં મેન્સમાં રાજપથ, વિમેન્સમાં કર્ણાવતી કલળ વિજેતા રોવિપાયન્સ ડ મીલ રનમાં રાજપથ-કર્ણાવતી ક્લબ વિજેતા

એશ. એસ. સ્પોટર્સના ઉપક્રમે સ્વાતંત્યદિન નિષિત્તે શહેરની વિવિધ કલય માટે ટ્રેડ મીલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યથ ક્લબનો દબદબો રહ્યો હતો. મેન્સ વિભાગમાં પ્રથમ સરમાંથી ત્રણ ટીમ રાજ્યથ કલબની રહી હતી જ્યારે વિષેના વિભાગમાં કર્શાવતી કલલની ટીમ વિજેતા ધની હતી.

આયોજક એવ. એસ. સ્યોટ્સના લિહાસ ત્રિવેદીએ જશાવ્યું હતું કે ભાગ લેનારી તમામ પાંચેય કલબ ખાતે શનિવારે રાષ્ટ્રગીત સાથે ઇવેન્ટનો પ્રાસ્ટેમ થયો હતો. પાંચેય કલબમાંથી ચાર-ચાર ટીમે ભાગ લીધો હતો અને મીલ પર દોડવાનું હતું.



હતો અને દરેક ટીમે એક-એક કલાક દોડવાનું હતું. આમ કલ ૨૫ ટીમે ભાગ કર્યું હતું. આ ટીમમાં પ્રજ્ઞા મોહન, લીયો તતો અને તેમને સતયોગ આપવા દિમાડી, જ્યોતિકા, કરિશ્મા, ક્ષતિ અને માટે ફિટનેસ ટ્રેનર પશ નિયુક્ત કરવામાં પનુશ્રીનો સમાવેશ થતો હતો. આવ્યા હતા. મેન્સ વિભાગમાં ચાર તથા વિમેન્સ વિભાગમાં એક ટોકી માટે સ્પર્ધા આમ કુલ ૨૦ ટીમની આ ઇવેન્ટ હતી. ધોલાઈ હતી અને એક ઓવરઓલ ટ્રોકી કાપીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ યેમાં દરેક રનરે લેન્લે કલાક સુધી ટેડ. પણ રાકવામાં આવી હતી. કર્ણાવતી ટીમમાં ભાવિન અગ્રવાલ, ડો. જગત કલધની મહિલાઓની ટીમે કલ છ પટેલ અને શૈલેપ જાવિયાનો સમાવેશ મહિલાઓની પાંચ ટીમે ભાગ લીધો કલાકમાં ૬૩.૭૧ કિલોમીટરનું અંતર થતો હતો.



કાર્ય્ય હતું અને મોખરાનું સ્થાન હૉસલ રાજ્યથ કલલની મેન્સ ટીમે છ કલાકમાં હસ.૯૦ કિલોમીટરનું અંતર




મેન્સ વિભાગમાં અન્ય સ્થાને રહેતી ટીમો આ મુજબ હતી.

બીજો ક્રમ : રાજ્યય કલય : ૯૯.૯૧ કલાકમાં કલ ૧૨૫૧ કિલોમીટરનું કિનોમીટર, ટીમ : ટિન્ક પરવાલી, તાર્દિક પટેલ, એડિયન જ્યોર્જ, ત્રીકો ક્રમ : એવિસપ્રિજ જીમખાના :


અને પ્રવીધ ચોથો ક્રમ : રાજપથ ક્લમ : ૬૪.૯૦ કિલોમીટર, ટીમ : કિરણ વસાલી, પંકજ - વિજેતાઓને ટોકી એનાયત કરી હતી.

યોરાવત અને દીપક પટેલ. આ સ્પર્ધામાં ટ્રેડ મીલ પર છ અંતર કવર કરવામાં આવ્યું નતં. તમામ પાંચેય કલબમાં એક સાથે રમતવીરોએ ભાગ લીધો હતો. રાજ્યથ 

સમારંભમાં ધાંચેય કલલના તોદેદારોએ ખાસ મહેમાન તરીકે હાજરી આપીને



15th August, 2016 6:00 AM to 12 Noon





# Support Required

- Send sms to participate & support the event to all members
- To provide 5 referees for the event
- To provide water, Nimbu Pani to participants & fruits (Banana & Oranges)
- Make announcement of the competition going on in the club/gym premises
- Provide light refreshment after the run.



# Thank You

### LS Sports Management Pvt. Ltd.

Contact: Surpreet Singh - 9662990546

Email: lssports.in@gmail.com

Website: www.lssports.in



